



Accredited Grade "A" by NAAC(3<sup>rd</sup> Cycle)

# સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

શારીરિક શિક્ષણ વિભાગ, યુનિવર્સિટી કેમ્પસ, યુનિવર્સિટી રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫

ફોન નં. : (૦૨૮૧) ૨૫૭૮૫૦૧ એક્સટે. નં. ૧૧૧

ઈ-મેઇલ : phyedu@sauuni.ac.in

નં.શા.શિ./ગુ.સ્થા.દિન/૦૨/૨૦૨૦

તા. ૦૩/૦૫/૨૦૨૦

પરિપત્ર :

વિષય : ગુજરાત સ્થાપના દિનની ઉજવણી ડિજિટલના માધ્યમથી કરવા બાબત.

સંદર્ભ ૧ : ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંક : મકમ/સ્થાપના દિવસ/૨૦૨૦/૫૬૨૪-૬૦૮૮

તારીખ : ૩૦-૦૪-૨૦૨૦

સંદર્ભ ૨ : મકમ/સ્થાપનાદિવસ/૨૦૨૦ તા.૦૧/૦૫/૨૦૨૦

આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત અનુસ્નાતક ભવનોના વડાશ્રીઓ તથા સંલગ્ન કોલેજોનાં આચાર્યશ્રીઓને ઉપરોક્ત વિષય અને સંદર્ભ-૨ ના સુધારા અન્વયે જણાવવામાં આવે છે કે દર વર્ષે ૧લી મે નાં રોજ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી જુદી જુદી રીતે સંસ્થાઓ અને સરકાર દ્વારા કરવામાં આવેલ છે. પરંતુ ચાલુ વર્ષે આપ સૌ સુવિદિત છે. આ ઉજવણીના ભાગરૂપે યોજનાર ઉપરોક્ત સ્પર્ધાઓમાં વિષયવસ્તુ "ગુજરાતના ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરિયર્સની ભૂમિકા" રહેશે. યુનિવર્સિટી સ્તરે યોજનાર આ ડિજિટલ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોમાંથી પ્રથમ, દ્વિતીય, અને તૃતીય આવનાર સ્પર્ધકોને ઈનામ જાહેર કરવાના રહેશે. તથા આ ત્રણ ક્રમાંકોને અનુક્રમે રૂ.૧૫૦૦૦/- રૂ.૧૧૦૦૦/- અને રૂ.૫૦૦૦/- રોકડ પુરસ્કાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી આપવામાં આવશે. શક્ય હોય તો આપનાં ભવનનાં અને કોલેજોનાં વિદ્યાર્થીઓનાં ગ્રુપ ઈ-મેઇલ/વોટ્સઅપ ગ્રુપ અથવા ડિજિટલ મિડીયા આપનાં સ્તરેથી જાણ કરી પ્રોત્સાહિત કરવા વિનંતી.

જે અંતર્ગત આપનાં ભવનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને કાવ્યલેખન સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક હોય તે વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ નીચે આપેલ ઈ-મેઇલમાં મેઇલ મોકલવાના રહેશે. અથવા ગુગલ ફોર્મની લીંકમાં તમામ વિગતો ભરી પોતાની કૃતિને અપલોડ/અટેચ કરવાની રહેશે. ગુગલ ફોર્મની લીંક:- <https://forms.gle/k8rL89YLeCdyA9im7>

ક્રમ	સ્પર્ધાનું નામ	સ્પર્ધા મુજબના ઈ-મેઇલ
૧	નિબંધ સ્પર્ધા (Essay Competition)	youthvoice2020eassy@gmail.com
૨	કાવ્યલેખન સ્પર્ધા (Poem Competition)	youthpoem2020@gmail.com
૩	ચિત્રકલા સ્પર્ધા (Drawing Competition)	youthdrawing2020@gmail.com

ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ સ્પર્ધા મુજબનાં ઈ-મેઇલમાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ નીચે મુજબ દર્શાવેલ ક્રમ ૧ થી ૦૬ ની તમામ વિગત તા.૦૭-૦૫-૨૦૨૦ સુધીમાં મોકલાવી આપે તેની જાણ આપનાં ભવન/કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને કરશોજી.

તા.ક.: ગુગલફોર્મની લીંક અને અન્ય વિગતો Physical Education Sectionમાં ડાઉનલોડ વિભાગમાં મુકવામાં આવેલ છે.

ગુગલ ફોર્મ અથવા ઈ-મેઇલમાં નીચેની વિગતો સ્પષ્ટ પણે ભરવી.

૧. સ્પર્ધાનું નામ : ચિત્ર સ્પર્ધા/ નિબંધ સ્પર્ધા/ કાવ્યલેખન
૨. ભવનનું/કોલેજનું નામ :
૩. વિદ્યાર્થીનું પુરૂ નામ :
૪. વિદ્યાર્થીનો મોબાઇલ નંબર.
૫. વિદ્યાર્થીનું ઈ-મેઇલ.
૬. ઉપરોક્ત આપેલ વિષય પર આપનાં દ્વારા રજૂ કરેલ કૃતિ મેઇલમાં એટેચ કરવી.
૭. ભાગ લેનાર વિદ્યાર્થીનો ફોટો

વધુ વિગતો માટે યુનિવર્સિટી કાર્યાલયના ૦૨૮૧ ૨૫૭૮૫૦૧ \*૧૧૧ \*૨૨૩ \*૪૨૭ નંબર પરથી માહિતી ઉપલબ્ધ થઈ શકશે.

શારીરિક શિક્ષણ નિયામક

પ્રતિ,

- (૧) સૌ.યુનિવર્સિટી સ્થિત અનુસ્નાતક ભવનના વડાશ્રીઓ/સંલગ્ન કોલેજોનાં આચાર્યશ્રીઓ,
- (૨) ડાયરેક્ટરશ્રી, કોમ્પ્યુટર સેન્ટરશ્રી (વેબસાઇટ દ્વારા પ્રસિદ્ધિ અર્થે)

નકલ સાદર રવાના :-

- (૧) માન.કુલપતિશ્રી/ માનઉપકુલપતિશ્રી/કુલસચિવશ્રીના અંગત સચિવશ્રી



# Saurashtra University Rajkot

Online Drawing, essay and poem competitions on Corona Worriers

ઓનલાઇન ડ્રોઇંગ નિબંધ અને કવિતા સ્પર્ધા

શીમ - કોરોના લડવૈયા

ગુજરાતનાં ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરિયર્સની ભૂમિકા

સ્પર્ધાના નિયમો		
ચિત્ર	નિબંધ	કવિતા
ડિજિટલ ચિત્રો અમાન્ય રહેશે ફક્ત કલર કે બ્લેક એન્ડ વ્હાઇટ સ્કેચ/ સ્વ હસ્તે ચિત્ર બનાવેલ હોવું જોઈશે	ફક્ત ત્રણ પેજ માં વધુ માં વધુ 1000 શબ્દોનો સ્વ હસ્તે ગુજરાતી ભાષામાં નિબંધ લખવો	100 થી 200 શબ્દોની કવિતા સ્વ હસ્તે ગુજરાતી ભાષામાં લખવી
ફક્ત એક ચિત્ર એક ઉમેદવાર દીઠ હોવું જોઈશે.	ફક્ત એક નિબંધ એક ઉમેદવાર દીઠ હોવો જોઈશે.	ફક્ત એક કવિતા એક ઉમેદવાર દીઠ હોવી જોઈશે.
ઈમેલ અથવા ગૂગલ ફોર્મ પર અપલોડ કરેલ હોવું જરૂરી છે.	ઈમેલ અથવા ગૂગલ ફોર્મ પર અપલોડ કરેલ હોવું જરૂરી છે.	ઈમેલ અથવા ગૂગલ ફોર્મ પર અપલોડ કરેલ હોવું જરૂરી છે.
નિર્ણાયકોનો નિર્ણય અંતિમ રહેશે	નિર્ણાયકોનો નિર્ણય અંતિમ રહેશે	નિર્ણાયકોનો નિર્ણય અંતિમ રહેશે
ઓરિજિનલ કોપી ની માંગણી કર્યે સત્વરે મોકલી આપવાની રહેશે	ઓરિજિનલ કોપી ની માંગણી કર્યે સત્વરે મોકલી આપવાની રહેશે	ઓરિજિનલ કોપી ની માંગણી કર્યે સત્વરે મોકલી આપવાની રહેશે
પોતાનો એનરોલમેન્ટ નંબર ફરજિયાતપણે અપલોડ કરેલ કોપી પર પોતાની સહી સાથે લખવાનો રહેશે.	પોતાનો એનરોલમેન્ટ નંબર ફરજિયાતપણે અપલોડ કરેલ કોપી પર પોતાની સહી સાથે લખવાનો રહેશે.	પોતાનો એનરોલમેન્ટ નંબર ફરજિયાતપણે અપલોડ કરેલ કોપી પર પોતાની સહી સાથે લખવાનો રહેશે.
ઇનામની રકમ વિજેતાના ખાતામાં જમા કરવામાં આવનાર હોઇ વિજેતાનો સંપર્ક ઈ-મેઇલ અથવા ફોનથી કરવામાં આવશે. તે સમયે સ્વ હસ્તે બનાવેલ ઓરિજિનલ કોપી પોતાની સાથે સારી સ્થિતિમાં લાવવાની રહેશે.	ઇનામની રકમ વિજેતાના ખાતામાં જમા કરવામાં આવનાર હોઇ વિજેતાનો સંપર્ક ઈ-મેઇલ અથવા ફોનથી કરવામાં આવશે. તે સમયે સ્વ હસ્તે બનાવેલ ઓરિજિનલ કોપી પોતાની સાથે સારી સ્થિતિમાં લાવવાની રહેશે.	ઇનામની રકમ વિજેતાના ખાતામાં જમા કરવામાં આવનાર હોઇ વિજેતાનો સંપર્ક ઈ-મેઇલ અથવા ફોનથી કરવામાં આવશે. તે સમયે સ્વ હસ્તે બનાવેલ ઓરિજિનલ કોપી પોતાની સાથે સારી સ્થિતિમાં લાવવાની રહેશે.